

પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા 2022

પરીક્ષાર્થીઓને સૂચના

1. પરીક્ષા તારીખ, સમય અને સ્થળ સાથેની હોલટિકિટ લોગઇન પાસવર્ડ નાખીને <https://gujaratvidyapith.org/admission/phd/> ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી સાથે રાખવી. (હોલટિકિટ માટે ટેકનિકલ મુશ્કેલી ઊભી થાય તો ફોન 079-40016210 મદદ મળશે.)
2. પરીક્ષા વખતે આ હોલ ટિકિટની સાથે બીજું ફોટો આઇડી કાર્ડ ઓરિજિનલ સાથે રાખવું. (આધાર, પાન કાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ.)
3. પરીક્ષાખંડમાં કાંડા ઘડિયાળ, માબોઈલ, કેલ્ક્યુલેટર, લેપટોપ વ. લઈ જવાની મનાઈ છે, અને પરીક્ષાખંડ બહાર મૂકવાની વ્યવસ્થા નથી, તેથી સાથે લાવવા નહીં. તે ખોવાઈ જાય તો તેની જવાબદારી ગૂજરાત વિદ્યાપીઠની રહેશે નહીં.
4. માસ્ક ધારણ કરવું ફરજિયાત છે.
5. બપોરે 12 થી 2 ની પરીક્ષા દરમિયાન પ્રથમ પ્રશ્નપત્ર બાર વાગ્યે શરૂ થશે અને એક વાગ્યે પૂરું થશે . (બપોરના સેસનનું પ્રથમ પ્રશ્નપત્ર 3-00 વાગ્યે ખુલશે અને 4-00 વાગ્યે પૂરું થશે.) પ્રશ્નપત્રમાં શરૂઆતના ત્રણ પ્રશ્નો અંગત માહિતીના છે, જેમા પ્રથમ પ્રશ્નમાં પોતાનું નામ લખવાનું છે. નામ લખવામાં પ્રથમ નામ પછી પિતાનું નામ અને છેલ્લે અટક લખવી. ત્યારબાદ બીજો પ્રશ્ન તમારો પરીક્ષા નંબર લખવાનો છે. પરીક્ષા નંબરમાં તમને જે પ્રમાણે ફાળવેલા છે તે પ્રમાણે પરીક્ષા નંબર લખવો અરજી નં. નહીં. જેમકે એજ્યુકેશન માટે EDU-1 .
6. સંશોધનના અને વિષયના પ્રશ્નો ચોથા પ્રશ્નથી શરૂ થશે, આથી પ્રશ્ન ક્રમાંક જે છે તે 4 નંબરથી 53 સુધીના રહેશે.
7. બન્ને પ્રશ્નપત્રો પૂરા થાય કે તરત સબમિટ કરવાના રહેશે.
8. સબમિટ કરશો તો જ પ્રશ્નપત્ર અહિયાં જમા થશે નહીંતર એની કોઈ વિગત પ્રાપ્ત થશે નહીં આથી દરેક પેપર સબમિટ કરવા પર બરાબર ધ્યાન રાખવું.
9. **પ્રથમ પ્રશ્નપત્ર સબમિટ કર્યા બાદ બીજું પ્રશ્નપત્ર ખોલી શકાશે. પ્રથમ પ્રશ્નપત્ર મહત્તમ એક વાગ્યા સુધીમાં તમારે સબમિટ કરવાનું રહેશે ત્યારબાદ submit કરી શકાશે નહીં. (બપોરના સેસનનું પ્રથમ પ્રશ્નપત્ર મહત્તમ 4-00 વાગ્યા સુધી સબમિટ કરવાનું છે.)**
10. બીજું પ્રશ્નપત્ર 12:30 પછી ખૂલશે અને તે 2 વાગ્યા સુધીમાં પૂરું કરવાનું છે. (બપોરના સેસનનું બીજું પ્રશ્નપત્ર 3.30 વાગ્યે ખુલશે અને 5-00 વાગ્યા સુધીમાં પૂરું કરવાનું છે.) તેમાં પણ શરૂના ત્રણ પ્રશ્નોમાં પોતાની વિગતો લખવી. પરીક્ષા સમય દરમિયાન કોઈએ અન્ય કોઈપણ પ્રવૃત્તિ કમ્પ્યુટર પર કરવી નહીં, તમને કોઈ પણ મુશ્કેલી લાગે તો સુપરવાઇઝરને જાણ કરવી.
11. દરેક માટે બન્ને પ્રશ્નપત્રની પરીક્ષા ફરજિયાત છે.
12. સુપરવાઇઝર કે ટેકનિકલ આસીસ્ટન્ટ સાથે પરીક્ષાના પ્રશ્નોની ચર્ચા કરવી નહીં પરીક્ષા પૂરી થાય એટલે પરીક્ષાર્થીને કેમ્પસ છોડીને બહાર જવાની સૂચના આપવી. કેમ્પસમાં કે કેન્ટિનમાં જવાની મનાઈ છે.